**E-PUBLIC - TENDER NOTICE** TENDER NO. / NAME OF WORK TENDER PERIOD

1. 3300007738: Tender for Running Industrial one year and Extendable for one more year at MRPL as per Tender Specification

Sale of Tender document From: 03.09.2020 to 03.10.2020 15.00 hrs Main Canteen Services for Pre Bid Meeting is on 15.09.2020 @ 10:30AM **Materials Department** 

Bid Submission closing date: 03.10.2020, 15.00 hrs Bid Opening Date: 03.10.2020, 15.30 hrs

For detailed information log on to Website: www.mrpl.co.in or www.tenderwizard.com & clici open tender link. All Amendments/Addendums/Corrigendum, Time Extension, clarifications, etc. shall be uploaded in the above mentioned Website(s) only and shall not be published in Newspapers. Prospective bidders should visit the above Website(s) to keep themselves update

and submit their bids based on the latest information/instructions hosted in Website(s). Together, Let us build a Clean India

<u>R0015</u>

### **ROOTS MULTI CLEAN LTD**

CIN: U36999TZ1992PLC003662 Regd. Office: R.K.G.Industrial Estate. Ganapathy, Coimbatore - 641 006 Website: www.rootsmulticlean.com, Email: gbala@roots.co.in Phone: +91 422 4330330 Fax:+91 422 2332107

Dear Member(s), Notice is hereby given that the 28" Annual General Meeting ("AGM") of the Company will be convened at 12.30 P.M. IST, on Tuesday, the 29" Day of September, 2020 through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business as set ou in the Notice of AGM which has been circulated by electronic mode (email) to the

In view of the continuing COVID-19 pandemic and in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules framed thereunder read with Genera Circular Nos. 14/2020 dated 8" April, 2020, 17/2020 dated 13" April, 2020 and 20/2020 dated 5" May. 2020, issued by the Ministry of Corporate Affairs ("MCA Circular(s)"), the Company has decided to conduct the AGM through VC/ OAVM facility without the physica resence of the Shareholders at a common venue.

The Notice of the 28th AGM and the Annual Report for the year 2020, including the Financia Statements for the year ended 31" March, 2020 ("Annual Report") has been sent only by e mail to all those Shareholders, whose e-mail address are registered with the Company o with their respective Depository Participants ("Depository") or with the Registrar and Share Transfer Agent (RTA) of the Company, in accordance with the MCA Circular(s) as mentioned above. Shareholders can join and participate in the 28" AGM through VC/OAVM facility only. The instructions for joining the 28" AGM and the manner of participation in the remote e-voting or casting vote through the e-voting system during the 28" AGM are provided in the Notice of the 28" AGM. Shareholders participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of th Companies Act, 2013.

Notice of the 28" AGM and the Annual Report has been made available on the website of the Company i.e., www.rootsmulticlean.com.

Shareholders who hold shares in physical mode and have not updated their email address with the Company/Depository Participant(s)/Registrar and Share Transfer Agents ("RTA") are requested to update their email address by writing to the Company's RTA M/s.S.K.D.C. Consultants Limited with subject line "Request to update email id" at info@skdc-consultants.com. Shareholders are requested to submit the request team mentioning the Folio No. and Name of Shareholder along with scanned copy of the Shareholder. Certificate (front and back) and self-attested copy of PAN card and any document (such a Driving Licence, Passport, Bank Statement, AADHAR) supporting the registered addres: of the Shareholder.

Shareholders holding shares in demat form can update their e-mail address & ban account details by submitting a request to the concerned depository participant.

Please note that the email ID gbala@roots.co.in is designated for the purpose of enabling shareholders to obtain Notice of the 28th AGM.

Pursuant to Finance Act, 2020, dividend income will be taxable in the hands of the shareholders w.e.f. 1st April 2020 and the Company is required to deduct tax at source ("TDS") from dividend payable to the Shareholders at the prescribed rates in the Income Tax Act, 1961 ("the IT Act"). For the prescribed rates for various categories and details documents required thereof, Shareholders are requested to refer to the Income Tax Act 1961 and Notice of 28" AGM in this regard. In general, to enable compliance with TDS requirements. Shareholders are requested to complete and / or update their Residentia Status. PAN, Category as per the IT Act by following the procedure as given below:

a. In case of shares held in demat form, Shareholders are requested to contact their espective depository participant.

b. In case shares are held in physical form, Shareholders are requested to send an e-ma along with the requisite details to info@skdc-consultants.com.

Shareholders may kindly note that in the event the Company is unable to pay the dividence to any Shareholder by electronic mode, due to non-registration of the Electronic Ban Mandate, the Company shall dispatch the dividend warrant to such Shareholders, at th earliest once the normalcy is restored.

Considering the above, we urge the shareholders to update their e-mail ID, Bank accourdetails & Permanent Account Number (PAN) with the Company / Depository Participant RTA to ensure receipt of the Annual Report, dividend and / or any other communication rom the Company. Notice is further given pursuant to Section 91 of the Act that the Register of Members and

Share Transfer books of the company will remain closed from September 23, 2020 to September 29, 2020 (both days inclusive) for the purpose of the AGM.

VOTING THROUGH ELECTRONIC MODE (E-VOTING)

The Company has entered into agreement with National Securities Depository Limited (NSDL), authorised e-voting agency, for facilitating voting through electronic mean: ("remote e-voting") to enable the Shareholders to exercise their right to vote on the esolutions proposed to be passed at the AGM as well as for Shareholders who are preser at the AGM through VC/OAVM facility and wish to cast their vote during the AGM through o voting system ("e-voting"). The manner of 'remote e-voting' and 'e-voting' during the AGM for Shareholders holding shares in physical mode, dematerialised mode and fo Shareholders who have not registered their e-mail address has been provided in detail in the Notice of the AGM.

In case of any grievances connected with facility for e-voting, please contact Ms. Pallav Mhatre, Manager, NSDL, 4" Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013. Email: evoting@nsdl.co.in Tel: 91 22 2499 4545/ 1800-222-990.

The above information is being issued for the information and benefit of all the hareholders of the Company and is in compliance with the MCA Circular/s.

For ROOTS MULTICLEAN LTD G. BALASUBRAMANIAM Company Secretary (FCS 9699) Coimbatore 13.08.2020

INDOKEM LIMITED

Registered Office: Plot No. 410/411, Khatau House, Mogul Lane, Mahim (West), Mumbai - 400 016 CIN: L31300MH1964PLC013088

Tel No.: 61236767/ 61236711 Email Id: iklsecretarial@gmail.com NOTICE

Notice is hereby given that the 54th Annual General Meeting (AGM) of INDOKEN LIMITED will be held on Tuesday, 29th September, 2020 at 3.00 P.M. through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the notice convenig the AGM.

The Communication and the Notice of the meeting is also available on the website of the Company www.indokem.co.in and on the website of BSE Limited at www.bseindia.com and at NSDL's website www.evoting.nsdl.com. Electronic copies of the Notice of AGM along with the Annual Report for the Financial yea 2019-2020 have been sent via email, to all members whose e-mail addresses are registered with the Company/Depository Participant(s) on September 3, 2020. Members are requested to refer to the procedure for registration of email address provided in the notes to the notice of the AGM.

Attention of members is also invited to following:

Pursuant to section 108 of the Companies Act, 2013 and the relevant rules framed there under, as amended from time to time, and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the proposed business as given in the Notice convening the AGM can also be transacted electronically through the remote electronic voting system provided by National Securities Depository Limited (NSDL). The remote e-voting shall commence on 26th September, 2020 (9.00 a.m) and

ends on 28th September, 2020 (5.00 p.m), after which remote e-voting shall not be allowed. Members of the Company holding shares either in physical or dematerialized

form, as on the "cut-off date (record date)" i.e. Tuesday, 22nd September 2020, only will be entitled to cast their vote electronically on all the businesse set forth in the Notice of the AGM.

Any person, who acquires the shares and have become member of the Company after the dispatch of the notice and holding shares as on the cut-off date can obtain their login ID and password by sending a request at evoting@nsdl.co.in.

The facility for voting by electronic means shall be available during the AGM("e voting"). The members who cast their vote by remote e-voting prior to the AGM may attend the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again; and A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-of date only shall be entitled to avail the facility of remote e

voting and e-voting at the AGM. Members who need assistance before or during the AGM for joining the AGM through VC or for electronic voting, can contact NSDL on: 1800-222990 o send a request at evoting@nsdl.co.in.

Book Closure:

Place: Mumbai

Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the Register of Members & Share Transfe Books of the Company will remain closed from 23rd September, 2020 to 29th September, 2020 (both days inclusive) for the purpose of 54th AGM.

The members are requested to communicate all their correspondence to the Registrars & Share Transfer Agent - M/s, Sharex Dynamic (India) Pvt. Ltd (Admin Office), at C-101, 207 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai-400 083. (Contact No: 22 - 28515644) (Email: support@sharexindia.com) For Indokem Limited

Rajesh D. Pisal Date: September 7, 2020 Company Secretary बैंक ऑफ़ इंडिया BOI onship beyond banking Head Office : Star House, C-5, G-Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051. Email : headoffice.share@bankofindia.co.in

NOTICE NOTICE OF SPECIFIED DATE - ELECTION OF ONE DIRECTOR OF THE BANK FROM AMONGST SHAREHOLDERS OTHER THAN THE CENTRAL GOVERNMENT TO BE CONDUCTED AT THE EXTRA-ORDINARY GENERAL

MEETING TO BE HELD ON THURSDAY 22nd OCTOBER 2020. Pursuant Pursuant to Regulation 12 of Bank of India (Shares & Meetings) Regulations 2007 (Bank's Regulations), as amended Notice is hereby given that Friday, 18th September, 2020 has been fixed as Specified Date for the purpose of determining the shareholders who shall be entitled to participate (i.e. nominate, contest and vote) in the Election of ONE Director of Bank of India, to be elected by the shareholders other than the Central Government from amonst themselves to be conducted pursuant to Section 9 (3) (i) of the Banking Companies (Acquisition and Transfer of Undertakings) Act, 1970, Nationalised Banks (Management & Miscalleeous Provisions) Scheme, 1970, Bank's Regulations, RBI Notifications and GOI Guidelines issued in this regard to be conducted at the Extra-Ordinary General Meeting (EGM) to be held on Thursday 22nd October 2020 through Video Conferencing / Other Audio Visual Means, herein after called as "e-EGM" on Thursday, October 22, 2020. The Head Office of the Bank shall be the deer venue of the meeting.

In view of the prevailing lock down situation across the country due to outbreak of the COVID-19 pandemic and restrictions on the movements apart from social distancing, MCA (Ministry of Corporate Affairs) vide circular Nos. Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 read with Circular No. 20/2020 dated May 05, 2020, SEBI circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 permitted companies to hold their AGM/ EGM through VC/OVAM for the calendar year 2020 and relaxed

certain provisions related to sending of notices.

The Electronic copies of the Notice of the EGM will be sent to all the shareholders whose e mail addresses are registered with the Bank /Depository Participants(s). Sharaholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depositary participants. Shareholders holding shares in physical mode are requested to demat their holdings/furnish their email addresses and mobile numbers with the Bank's Registrar and Share Transfer

Agents on or before Friday, September 18, 2020. Further, Shareholders may temporarily get their email id registered by clicking the link www.bankofindia.co.in The Notice of EGM will also be made available on Bank's Website www.bankofindia.co.in and on the website of Stock Exchanges i.e www.nseindia.com and www.bseindia.com.

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the EGM through electronic voting system. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders. The details will also be made available on the website of the Bank. Shareholders are requested to visit www.bankofindia.co.in to obtain such details.

Shareholders may please note that in terms of aforementioned, the Bank will not be sending physical copies of EGM Notice to the Shareholders

Place: Mumbai Date: 05.09.2020

For BANK OF INDIA Managing Director & CEO

MAHESHWARI LOGISTICS LIMITED CIN: L60232GJ2006PLC049224 CIN: LDU324CU2000FLCV046Z24 Registered Office: MLL House, Shed No. A2-3/2 OPP. UPL 1st Phase, GIDC, Vapi Valsad Gujarat-396195. Tel. No. 260-2431024 Fax. No. 022-2427024 Website: www.mlpl.biz Ernail: info@mlpl.biz

NOTICE OF 14TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING AND RECORD DATE

lotice is hereby given that,

The 14th Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday 30th September, 2020 at 2.00 p.m (IST) through video conference (VC)/other Audio Visual means (OAVM), to transact the business as mentioned in the notice of AGM.

In view of the continuing Covid-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 (hereinafter collectively referred to as 2020 and Circular No. 17 dated April 13, 2020 (referentative Collectively reterred to as "MCA Circulars") permitted the holding of Annual General Meeting through VC or QAVM without the physical presence of Members at a common venue. In compliance with these MCA Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual General Meeting of the Members of the Company will be held through VC/OAVM.

The Company has completed dispatch of Electronic copies Notice of the AGM along with the Annual Report for the financial year 2019-20 by electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories as on cut off date August 28, 2020 in accordance with the aforesaid MCA Circulars and circular issued SEBI dated May 12, 2020.

Members may note that the Notice of AGM and Annual Report for the financial year 2019 20 is also be available on the Company's website <a href="https://www.mipl.big">www.mipl.big</a> and website of the Stock Exchanges i.e. NSE Limited at <a href="https://www.nseindia.com/">https://www.nseindia.com/</a> Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under S of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") through National Securities Depository Limited (NSDL) to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the Annual General Meeting ("e-voting") Detailed procedure for remote e-voting/ e-voting and joining AGM is provided in the

The remote e-voting shall commence on September 27, 2020 (9.00 a.m. IST); and

ends on September 29, 2020 (5.00 p.m. IST); E-voting by electronic mode shall no be allowed beyond 5:00 p.m. IST on September 29, 2020 and the same shall be sabled by the NSDL thereafter.

Any person who acquires the shares of the Company becomes the shareholder after dispatch of notice of AGM and holding share as on cut-off (i.e September 23, 2020) should follow the same procedure for e-voting as mentioned in the Notice.

Members may note that once the vote on a resolution is cast by the members, sha Members may note that once the vote on a resolution is cast by the members, sha not be allowed to change it subsequently. The members who have cast their vote by remote e-voting prior to the meeting may attend the meeting but shall not be entitled to cast their vote again. The facility for voting through ballot or any other permitted mode shall be made available at the venue of the AGM.

The procedure of electronic voting is available in the notice of the AGM. In case of arry queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of <a href="https://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in

ted to read all the notes set out in the AGM notice and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote E-Voting or E-Voting at the AGM.

By Order of the Board

Paresh Raivar

Dated: 05.09.2020 Place: Vapi Company Secretary & Compliance Officer FORM G

INVITATION FOR EXPRESSION OF INTEREST

RTICULARS Simhapuri Energy Limited December 02, 2005 Registrar of Companies - Name of the corporate debtor Date of incorporation of corporate del
 Authority under which corporate npanies - Hyderabad under the incorporated/registered
4.Corporate identity number/limited liability Companies Act, 1956 U40101TG2005PLC048264

identification number of corporate debtor 5.Address of the registered office and principal -98/5/110. Plot no. 110. 2nd Floor, Kavuri Hills luttala Begumpet Village, Serilingampaliy Mandal, Iyderabad 500033, Rangareddi, Telangana, India fyderabad 50 une 26, 2020 6.Insolvency commencement date of the corpora debtor
7. Date of invitation of expression of interest eptember 07, 2020 e detailed invitation for expression of interest is alable on the website of the corporate debtor at

www.simhapurienergy.com
The eligibility criteria is set out in the detaile Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at: on for expression of interest, which can be btained from www.simhapurienergy.com hese norms are set out in the detailed invit

9. Norms of ineligibility applicable under section www.simhapunenergy.com. Also available at the website of IBBI (https://ibbi.gov.ir/legal-framework/ by an email to insim@deloitte.com

Last date for receipt of expression of interest
 Date of issue of provisional list of prospect

provisional list

13.Date of issue of final list of prospective applicants
14.Date of issue of Information memory

prospective resolution applicants
15. Manner of obtaining request for resolution plan
eveluation mattin, information memorandum and Will be shared in electronic formby the resolution Will be shared in electronic formby the resolution professional to prospective resolution applicans who are determined to be eligible as per the process laid down in the detailed invitation for expression of the Insolvency and Bankruptoy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016.

November 12, 2020
Will be shared in electronic form by the resolution professional to prospective resolution applicants who are determined to be eligible as per the process laid down in the detailed invitation for expression of interest and in accordance with Regulations 36A and 36B of the insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016.

December 08, 2020

18 Estimated date for submission of resolution pla to the Adjudicating Authority for approval

19. Name and registration number of the resolution Name: Anish Niranjan Nanavaty Regn. No.: IBBI/IPA-002/IP-N00272/2017 Regn. No.: IBBI/IPA-002/ 8/10830 Name: Anish Niranjan Nanavaty

20.Name, Address and email of the re Registered Address:
2A/208, Raheja Classique, New Link Road,
Andher(W), Mumbal 400053
E-mall: anish.nenavaty.inp@gmail.com
Communication Address:
Deloitte Touche Tohmstou India LLP, Indiabulis
Finance Centre Tower 3, 27 Floor, Senapeti Bapat
Marg, Elphinstone Read (W), Mumbal 400013 cistered Address 21.Address and email to be used for

:-mail d: insim@deloitte.com
:-mail request to insim@deloitte.com or the 22. Further Details are available at or with 23. Date of publication of Form G

sd/Anish Niranjan Nansvaty
IBBNIPA-002/IP-N00272/2017-18/10830
Registered Address: 2A/208, Reheje Classique
Registered Email: anish nansvaty.im@gmail.cs
For Simhaput Energy Limited
Date: September 07, 2020
Place: Mumbel sique, New Link Road, Andheri(W), Mumbei 400053 disht/

d2h

DISH TY INDIA LIMITED

Corp. Office: FC - 19, Sector 16 A, Noida - 201301, U.P Regd. Office: 18th Floor, A Wing, Marathon Futurex, N M Joshi Marg, Lower Paret, Mumbai -400013 E-mail: investor@dishd2h.com, CIN: L51909MH1980PLC287553, Website: www.dishd2h.com Tel: 0120-5047000, Fax: 0120-4357078

### NOTICE OF 32™ ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 32<sup>rd</sup> Annual General Meeting [AGM] of the members of Dish TV India Limited will be held on Tuesday, September 29, 2020 at 11:00 AM (IST) through Video Conferencing (VC)/Other Audio Visual Means (DAVM) to transact the businesses as set forth in the notice of the AGM of the Company, in compliance with all applicable provisions of the Companies Act, 2013 ('the Act') and the rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), rea with Ministry of Corporate Affairs ( MCA) Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 14/2020 date April 08, 2020 & Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/7 dated May 12, 2020 issued by Securities and Exchange Board of India (collectively referred to as 'relevan

In compliance with the Relevant Circulars, the Notice of the AGM along with the annual report for the financi year 2019-20 has been electronically sent on Sunday, September 6, 2020 to those members who have registered their email IDs with the Company/Depository Participant(s). The copy of the Annual Report is also available on the website of the Company at www.dishd2h.com/annual-reports/, on the Website of the BSE Limited (BSE) at www.bseindia.com, on the website of National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com and also on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The relevan documents pertaining to the items of the business to be transacted at the AGM shall be kept open for inspection by the members online during the AGM through video-conference.

The vanue of the meeting shall be deemed to be the Registered Office of the Company. Members participatin through YC/OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act. The facility for pointment of Proxies by the Members will not be available since this AGM is being conducted through YC/OAY

## nstructions for remote E-voting and E-voting during the AGM:

- Pursuant to section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration Rules 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations 2015 the Company is pleased to provide the facility to the members to exercise their right to vote by electroni means on resolutions proposed to be passed at AGM. Members holding shares either in physical form of dematerialized form as on Tuesday, September 22, 2020 (cut-off date), can cast their vote electronical through electronic voting system (remote e-voting) of NSDL at www.evoting.nsdl.com. A person whose name is recorded in the Register of Members or in the Registrar of Beneficial Owners maintained by the Depositories as on cut-off date shall be entitled to avail the facility of remote e-voting at the AGM.
- The remote E-voting period will commence at 9:00 am on Friday, September 25, 2020 and will end at 5:00 pm on Monday, September 28, 2020. Thereafter the E-Voting module shall be disabled by NSDL. Once the vot on a resolution is casted by members, the members cannot modify it subsequently.
- Members who have acquired shares after the sending of the Annual Report through electronic means ar before the cut-off date i.e. Tuesday, September 22, 2020, may obtain the USER ID and Password by sending a request at evoting@nsdl.co.in or investors@dishd2h.com. However, if a person is already registered with NSDL for remote e-voting then you may use your existing USER ID and Password, and cast your vote Members attending the A6M who have not cast their vote by remote e-voting shall be eligible to cast their vote through e-voting during the A6M. Members who have voted through remote e-voting during the A6M. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM, however they shall not be eligible to vote at the meeting.
- Shareholders holding shares in physical mode and who have not updated their email addresses with th Company are requested to get their email registered with the company's Registrar and Transfer Agents Link Intime India Private Limited by clicking the link: https://linkintime.co.in/emailreg/email\_register.html or by writing to RTA with their details. Shareholders holding shares in dematerialized mode are requested to /undate their e-mail addresses with the concerned Depository Participant(s

The procedure of electronic voting is mentioned in the Notice of the AGM and is also available on the websi of NSDL viz. www.evoting.nsdl.com. In case of queries, members may refer to Frequently Asked Question: [FAQs] and e-voting user manual for Members available in the download section of the e-voting website of NSDL www.evoting.nsdl.com. Members who need assistance before or during the AGM may send a reques at evoting@nsdl.co.in or use Toll free no: 1800-222-990 or Contact Mr. Amit Vishal, Senior Manager, NSDL a the designated email ID: evoting@nsdl.co.in or amitv@nsdl.co.in or at telephone number 022-24994360 o Contact Ms. Pallavi Mhatre, Manager, NSDL at the designated email ID : evoting@nsdl.co.in o pallavidfönsdl.co.in or at telephone number 022-24994545.

Any query or grievance connected with the AGM, other than E-Voting, may be addressed to the Compa Secretary at investor@dishd2h.com or at the corporate office address or members may contact Ms. Trupt Parab, Link Intime India Private Limited, the Registrar & Share Transfer Agent of the Company at C-101, 247 Park, LBS Marg, Vikhroti (West), Mumbai - 400 083, Tet; +91 022 49186270, Fax: +91 022 49186060, E-mail: mt.heladeskfdlinkintime.co.in

For Dish TV India Limiter

Place: Kolkata

Date: 5th September, 2020

Date: September 6, 2020

Company Secretar

## **Asian Hotels (East) Limited**

CIN No.: L15122WB2007PLC162762 Regd. Office: Hyatt Regency Kolkata,
JA-1, Sector-III, Salt Lake City, Kolkata 700 098,W.B, India
Phone: 033 6820 1344/46, Fax: 033 2335 8246,
Email ID: investorrelations@ahleast.com; Website: www.ahleast.com NOTICE OF 13TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING &

**BOOK CLOSURE DATES** Notice is hereby given that the Thirteenth (13th) Annual General Meeting ('AGM' or 'Meeting') of Asian Hotels (East) Limited ('the Company') will be held or Monday, 28th September, 2020 at 3:00 p.m. (I.S.T) through Video Conferencing ('VC'). Other Audio Visual Means ('OAVM'), to transact the business set out in the Notice 3th AGM dated 31st July, 2020.

In accordance with the General Circular issued by the Ministry of Corporate Affair dated May 5, 2020 read with General Circulars dated April 8, 2020 and April 13, 2020 (collectively referred to as 'MCA Circulars') and Securities and Exchange Board o india ('SEBI') Circular dated May 12, 2020, the Company has completed dispatch o the Notice of the 13th AGM along with the Annual Report 2019-20 on Sunday, 6th September, 2020, through electronic mode only to those Members whose e-ma addresses are registered with the Company or Registrar & Transfer Agent and Depositories. The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with vide MCA Circulars and the SEBI Circulars. Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 201 isting Regulations) and Secretarial Standards on General Meetings (as ame the Company shall be providing remote e-voting (facility to cast vote prior to AGM and also e-voting during the AGM to the Members on all resolutions set forth in the Notice through National Securities Depository Limited ("NSDL") as an e-voting agenc in respect of the business to be transacted at the AGM. All the members are furthe

The remote e-voting will commence on Friday, 25th September, 2020 at 9:00 a.m. and ends on Sunday, 27th September, 2020 at 5:00 p.m. The remote e-voting module shall be disabled for e-voting thereafter and shall not be allowed beyond the said date and time and once the vote on a resolution is cast by the member

the member shall not be allowed to change it subsequently. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Monday, 21st September, 2020.

Any person, who acquires shares of the Company and becemes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e.Monday, 21st September, 2020 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user ID and password car

be used for casting vote;

The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote once again. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date shall be entitled to

avail facility of remote e-voting or e-voting at the AGM;
The Annual Report (2019-20) of the Company, inter alia, containing the Notice and
the Explanatory Statement of the 13th AGM is available on the website of the Company at www.ahleast.com and on the websites of the Stock Exchanges viz www.bseindia.com and www.nseindia.com. A copy of the same is also available on the website of National Securities Depository Limited ('NSDL') ai www.evoting.nsdl.com.

case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs and e-voting user manual for shareholders available at the download section o Manager-Legal & Secretarial at soumyasaha@sarafhotels.com or send email to evoting@nsdl.co.in for further clarifications.

ursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulatior 42 of the Listing Regulations, 2015, the Register of Members and the Share Transfel Books for equity shares of the Company will remain closed from Tuesdey, 22nd September, 2020 to Monday, 28th September, 2020(both days inclusive)

> For Asian Hotels (East) Limited Saumen Chatterjee Chief Legal Officer & Company Secretary

Maharaja Shree **UMAID MILLS LIMITED** 

Regd. Office: 7, Munshi Premchand Sarani, Hastings, Kolkata-700022
Phone: +91-33-22230016; Fax: +91-33-22231569; E-mail: kolkata.msum@inbgroup.con : www.msumindia.com; CIN: U17124WB1939PLC128650

Head Office and Works: Jodhpur Road, Pali - 306 401 (Rajasthan)
Phone: +91-2932-220286/288; Fax: +91-2932-221333; Email: ho.msum@lnbgroup.cor NOTICE OF THE 80TH ANNUAL GENERAL MEETING.

BOOK CLOSURE ANDE-VOTING INFORMATION

Notice is hereby given that the 80th Annuel General Meeting(AGM) of the Members of MAHARAJA SHREE UMAID MILLS LIMITED will be held on Monday, the 28th day of September, 2020 at 2:30 P.M., Indian Standard Time ("IST"), through Video Conferencing/ Other Audio Visual Means ("VC/OAVM" vithout the need of the physical presence of the member, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder read with General Circular numbers 14/2020, 17/2020, 20/2020 dated April 8, 2020, April 13, 2020 and May 5, 2020 respectively issued by

Ministry of Corporate Affairs (MCA), Government of India In Compliance with the aforesaid Circulars issued by the MCA, the Annual Report for the financial year ended 31st March, 2020 consisting of financial statements including Board's Report, Auditors' Report and other documents required to be attached therewith including Notice of the 80th AGM of the Company inter alia indicating the process and manner of e-voting have been sent electronically to all the Shareholders whose Email IDs are registered with the Company/Depository Participant(s) and to all other persons so entitled.

Members may also note that the Notice of the 80th AGM and the Annual Report 2019-2020 will also available on the Company's website www.maumindia.com. The Notice of the AGM shall also be available on the website of Central Depository Services (India) Limited (CDSL) at

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014 as amended by the Companies (Management and Administration Amendment Rules, 2015 w.e.f 19th March, 2015, Clause 7.2 of Secretaria Standard on General Meeting (SS-2), and MCA Circulars, the Company is pleased to provide to its members the facility of voting by electronic means in respect of the business to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with Central Depository Services (India) Limited (CDSL) for facilitating voting through electronic means, as the authorized e-Voting's agency. The facility of casting votes by a member using remote e-voting as well as the e-voting system on the date of the AGM will be provided by CDSL.

M/s. Vinod Kothari and Company, Practicing Company Secretaries have been appointed as the Scrutinizer for conducting the e-voting in a fair and transparer

# All the Members are hereby informed that:

- The remote e-voting period begins at 10:00 a.m. on Friday, 25th September, 2020 and ends at 5:00 p.m. on Sunday, 27th September 2020. The remote e-voting module shall be disabled by CDSL thereafte
- The Members of the Company holding shares either in physical form or dematerialized form as on the cut-off date i.e. 21st September, 2020. only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- The voting rights of the Members shall be in proportion to their shareholding C) in the Company as on 21st September, 2020 (cut-off date). Any person, who acquire shares and became the Member of the Company afte dispatch of the Notice but before the cut-off date (i.e. 21st September 2020), may obtain the Sequence Number by sending a request to the Company's Registrar and Share Transfer Agent, M/s. Maheshwari Datamatics Private Limited, at an email id: mdpldc@yahoo.com.
- The Members of the Company holding shares either in physical form or in dematerialized form, as on the closing of working hours of Cut-off Date (i.e. 21st September, 2020) and not cast their vote through remote e-voting, may cast their vote at the AGM through e-voting. A member may participate in the meeting even after exercising his/her/its right to vote through remote e-voting, but, shell not be allowed to vote again in the meeting. Once the vote is cast by the member, the member shall not be allowed to change it subsequently. In case you have any queries or issues regarding e-voting, you may
- available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunde (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542). All grievances connected with the facility for voting by electronic me may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL, ) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futures

Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East),

Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com

refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual

NOTICE is hereby further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and the applicable rules framed thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday, 22nd September, 2020 to Monday, 28th September, 2020 (both days inclusive) for the purpose of Annual General Meeting.

or call on 022-23058542/43.

Plece : Kolkata

Date: 06.09.2020

By order of the Board of Directon For Maharaja Shree Umaid Mills Limited Date:05.09.2020 Sd/

L. N. Bangur Chairman & Managing Director

# **UDAY JEWELLERY INDUSTRIES LIMITED**

Regd Office.: 3-6-291/4/A, 1st Floor, Hyderguda, Hyderabad- 500 029; Ph: 040-48538411, E-mail: info@udayjewellery.com; website: www.udayjewellery.com; CIN: L74900TG1999PLC080813 NOTICE OF THE 21STANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 21stAnnual General Meeting (AGM) of the Members of UdayJewellery Industries Ltd ('Company') will be held through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), on Monday, September 28, 2020 at 01:30 PM IST to transact the Ordinary & Special Business as detailed in the Notice dated 27th August, 2020, convening the said AGM. In view of the continuing COVID-19 pandemic and the restrictions thereon, the Ministry of Corporate Affairs has vide Circular dated 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020 ("MCA Circulars") and Circular dated 12th May, 2020 issued by Securities and Exchange Board of India ("SEBI Circular"), permitted Companies to convene the AGM through VC/OAVM mode and issue the Notice for Annual General Meeting along with the Annual Report for the Financial Year 2019-20 by email to all members and other persons entitled, and whose e-mail addresses are registered with the Company.

Notice of AGM and Dispatch In terms of the Section 101 of the Companies Act, 2013 read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, the aforesaid Notice and the Annual Report (including Financial Statements) for the Financial Year 2019-2020 have been sent through e-mail to all the Members whose e-mail addresses are registered with the Depository Participant(s)(DP)/Registrar & Transfer Agent (RTA) / Company on 04th September 2020.Annual Report and Notice of AGM has been sent to all members holding shares as on 28th August 20 The Annual Report elong with AGM Notice is website at www.udayjewellery.comThe Notice convening the AGM is also available on www.evotingindia.com,www.bseindia.com Members who have acquired shares in the Company after the said date, or who have not registered their e-mail address with the DP/RTA/Company can access the Annual Report on the above wabsites and send a request to your DP/RTA/Company for receipt of the same along with

Closure of Register of Members and Share Transfer Books

NOTICE is further given pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Tuesday 22nd September, 2020 to Monday, 28th September, 2020 (both days inclusive) for the purpose of Annual General Meeting. Members and all other persons concerned are hereby requested to take note of the same and lodge the share transfer deed(s), if any, duly executed, with the Registrar & Transfer Agent (RTA) and also notify change in their address/bank account particulars, if any, to the RTA (in respect of shares held in physical form) or directly to their Depository Participant(s) (in respect of shares held in demat form) on or before 21st September, 2020 ("cut off date"). All shareholders holding shares as on cut off date shall be eligible to cast their vote and attend the AGM of the Company Manner of Voting at the AGM (remote e-voting and e-voting at AGM)

NOTICE is further given that in compliance with Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing e-voting facility (remote e-voting and e-voting at the AGM) to all its Shareholders to enable them to cast their votes on all matters listed in the said Notice through electronic means. The Company is pleased to provide E-voting facility (including "remote e-voting") of CDSL to all its Members to cast their vote on all resolutions set out in the Notice of the AGM. Members will be able to cast their vote electronically on the businesses as set forh in the Notice of the AGM either remotely (during remote e-voting period) or during the AGM (when window for e-voting is activated upon instructions of the Chairman).

Cut-Off Date for determining the Members Monday, 21stSeptember, 2020 entitled to vote through e-voting Commencement of e-voting period Thursday, 24th September, 2020 (9:00 AM) End of e-voting period Saturday 26th September 2020 (5:00 PM)

The members who cast their vote through remote e-voting may attend the AGM but will not be allowed to vote again at the AGM. The detailed instructions for casting the vote through e-voting is attached to the AGM Notice as well as available on the Company's website on <a href="www.udayjewellery.com">www.udayjewellery.com</a> and on websites at www.evotingindia.com and www.bseindia.com. Any person who becomes a Member of the Company after the dispatch of the

Notice convening the AGM and holds shares as on the cut-off date may obtain the LOGIN ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com or bsshyd@bigshareonline.comHowever, if such person is already registered with CDSL for e-voting then sine can use his/her existing USER ID and password for casting vote. Any person who is not a shareholder as on the cut-off date may consider this notice for informational purposes only.

Attendance to the AGM through VC/OAVM:

Members are requested to note, that in view of the MCA Circulars, the Company is pleased to provide attendance to the AGM through VC/OAVM facility. The Share holders will be required to login on www.evotingindla.com using their e-voting User ID and password. The link to view and participate in the AGM proceedings will be available on www.evotingindia.com. The details for participation to the AGM registration as a Speaker and to ask questions on the agenda for the AGM are included in the Notes to the AGM Notice. The members are requested to refer the same in detail. Members who have not updated their e-mail addresses are requested to update the same with their DP by sending a written request by email to bsshyd@bigshareonline.com.

In case of any queries/grievances, connected with facility for voting by electronic means, please contact Mr. Rakesh Dalvi, Manager, and CDSL email; evoting@cdslindia.com or call 1800225533. Members may contact Mr. S.D. Prabhakar, Deputy General Manager, Bigshare Services Private Limited, Hyderabad on phone number 040-40144967 or e-mail to bsshyd@bigshareonlina.com.

The instructions for e-voting and participation in the AGM shall also form a part of the AGM Notice of the Company, which shall be available on the website of the Company, CDSL and the Stock Exchanges. This Advertisement is being published in compliance of the MCA Circulars and for the information of the members as is available on the Stock Exchanges website and the website of the Company. We urge all members to update their information at the earliest to receive the

AGM Notice, Annual Report and e-voting credentials (as applicable) By Order of the Board of Directors For Uday Jewellery Industries Limited Sd/-

Ritesh Kumar Sanghi Managing Director DIN: 00628033

Place:Hyderabad

# ગુજરાતમાં ૧૭ હજારથી વધ દકિઓ સારવાર હેઠળ અમદાવાદ, તા. દ આપવામાં સફળ થતા કોરોના ડિસ્ચાર્જ ૧૫૨ અને ગ્રામ્યમાં ૨૧ પળ ૧૭૩, મોરબીમાં ૨૧, નર્મદામાં ૨૩, ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં દર્દીનો આંક ૮૩૯૧૭ ઉપર પહોંચ્યો છે. રાજકોટમાં ૧૫૧, જામનગરમાં ૧૧૪, નવસારીમાં ૧૧, પંચમહાલમાં આંક ૨૭,૮૦,૮૬૧ ઉપર પહોંચ્યો છે.

વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી ૮૦.૪૬ ટકા ઉપર પહોંચ્યો છે. છે. વિતેલા ૨૪ કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૩૩૫ ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય ૩૨ ૧૪, અરવલ્લીમાં ૪, બનાસકાંઠામાં નોંધાવા પામ્યા છે. પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. જેને ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૪

નવા વોર્ડ સીમાંકન માટેનું પ્રાથમિક

ભારત બીજા ક્રમાંકે પહોંચ્યું છે. આવી જ જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર ભાવનગરમાં ૪૯, ગાંધીનગરમાં ૩૧, પાટણમાં ૧૬, પોરબંદરમાં ૩, ગુજરાતમાં હાલ ૧૭,૦૯૫ એક્ટિવ ૪૧, જુનાગઢમાં ૨૯, વોડદરામાં સાબરકાંઠામાં ૧૫, સુરેન્દ્રનગરમાં ૨૧, કેસ છે. જેમાં ૯૨ વેન્ટિલેટર ઉપર અને વિતેલા ૨૪ કલાક દરમિયાન ૧૨૭, અમરેલીમાં ૨૩, આણંદમાં તાપીમાં ૧૩, જ્યારે વલસાડમાં ૮ કેસ ૧૬૩૮૩ સ્ટેબલ છે.

# વઈને ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સાથે પોઝિટિવનો આંકડા ૧૦૪૨૯૬ અને વધુ ૧૪નાં મોત કેસનો આંકડો ૧,૦૪,૨૯૬ ઉપર પહોંચ્યો છે. આમ સતત અનલોક-૪માં પાંચમા દિવસે કોરોના પોઝિટિવના કેસ ૧૩૦૦ નોંધાયા છે. બીજી બાજુ વિતેલા કેસ રેડેના મુક્ત થઈ જતાં રિકવરી દર ૮૦.૪૬ ટકા; હજુ ૧૭૦૯૫ સારવાર હેઠળ

કોરોના દર્દીના મૃત્યુ થતાં કોરોનાના જિલ્લામાં કોરોના પોઝિટિવના ૧૩૩૫ ૧૨, ભરૂચમાં ૨૨, બોટાદમાં ૩, દર્દીનો મૃત્યુઆંક ૩૨૮૪ થયો છે. બીજી કેસ નોંધાવા પામ્યા છે. જેમાં આજે પણ છોટાઉદેપુરમાં ૬, દાહોદમાં ૧૭, ગુજરાતમાં ૧૪ કરોના દર્દીના મોત વધુ ૭,૩૫,૯૫૨ બાજુ આજે સૌથી વધુ સારી વાત એ છે કે સુરતમાં સૌથી વધુ કેસ નોંધાવા પામ્યા દેવભૂમિદ્વારકામાં ૧૨, ગીરસોમનાથમાં નોંધાવા પામ્યા છે. જેમાં સુરતમાં પ, ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં છે. સુરત શહેરમાં ૧૮૫ અને ગ્રામ્યમાં ૧૫, ખેડામાં ૧૧, કચ્છલમાં ૨૯, અમદાવાદમાં ૩ જ્યારે ગાંધીનગર, ગીર ગતરોજના ક્વોરેન્ટાઈન દર્દીઓમાં ૧૨૦૭ કોરોના દર્દીઓ કોરોનાને મહાત ૧૧૦ મળીને ૨૯૫, અમદાવાદ શહેરમાં મહીસાગરમાં ૫, મહેસાણામાં ૨૯, સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને સૌથી વધુ ૧,૬૭,૯૫૨નો ઉછાળો

હવે આમાં કોર્પોરેટરોને હજી કોર્પોરેટર હાજર રહ્યા હતા, એમાં વિપક્ષ

વિતેલા ૨૪ કલાક દરમિયાન ક્વોરેન્ટાઈનમાંથી ગુજરાતમાં ૭૨,૫૬૧ લેબોરેટરી વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને ૨૧૬૨ ફેસીલિટી ક્વોરેન્ટાઈન હેઠળ છે.

વિતેલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વડોદરામાં ૧-૧ મોત નોંધાવા પામ્યા છે. આવ્યો છે. ૭,૩૫,૯૫૨ વ્યક્તિઓના

🔳 અભિનેત્રી કંગના રાણાવતના વિરોધ સંબંધે શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉત દ્વારા આપવામાં આવેલાં અશોભનીય નિવેદનો સામે વ્યાપક વિરોધ ઊઠ્યો છે. સ્ત્રીદાક્ષિણ્યની જીવતી જાગતી મિશાલ સમાન છત્રપતિ શિવાજી મહારાજની મહાન પરંપરાનો ધરાર ભંગ થાય તેવા વિધાનો સામે કરણીસેનાના યુવા કાર્યકર્તાઓ દ્વારા આજે પરવટ પાટિયા વિસ્તારમાં સૂત્રોચ્ચાર સાથે સંજય રાઉતના પૂતળાને જૂતાનો હાર પહેરાવી વિરોધ કરવામાં (તસવીરઃ પ્રદીપ ગોહીલ)

# નવા વોર્ડ સીમાંકન સામે વાંધા, સૂચનો મેળવવા કોંગ્રેસની બેઠકમાં અડધો અડધ સભ્યો ગેરહાજર સુરત, તા.૬ છે કે રૂપ પૈકી વિપક્ષ નેતા સહીત માત્ર પક્ષની બેઠકમાં હાજર સુધ્ધા રહ્યા નથી. વરસાદે વિરામ લેતાં બફારા અને ગત ગુરુવારના રોજ સુરત શહેરના ૧૬ કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા. આજની બેઠકમાં ૩૫ પૈકી જે

જાહેરનામુ જાહેર થયા બાદ ૧૦ પોતાના વોર્ડમાં શું રહ્યું, શું કપાયું એની નેતા પપ્પન તોગડિયા, દિનેશ કાછડિયા, દિવસનો વાંધા સૂચન નોંધાવવાનો જ સમજ કેટલી પડી, એ પણ ખબર નથી. દિનેશ સાવલિયા, મનોજ ચોવટિયા, સમય અપાયો છે. આ વોર્ડ સીમાંકનમાં આવા સમયે શહેર કોંગ્રેસના અભ્યાસુ દેવરાજ ગોપાણી, નરેશ જીયાણી કોંગ્રેસના કબજામાં રહેલ વોર્ડ તોડીને સભ્યો, નેતાઓની પેનલ, સીમાંકન ધનસુખ રાજપૃત, ભદ્રેશ પરમાર, ટુકડા કરી અન્ય વોર્ડોમાં ભેળવી દેવાયા \_જાહેર થયાના બીજા જ દિવસથી બેસાડી, \_અસલમ સાયકલવાળા, ભાવેશ રબારી

સામનો કરી રહ્યા છે. વાતાવરણ પણ ધુમ્મસ રહ્યો છે. દરમિયાન 🗕

૩૫.૪ ડીગ્રી નોંધાયું હતું.

ઉકળાટથી સુરતના લોકો ત્રાહિમામ સુરત: શહેરમાં મેઘરાજીએ વિરામ હતી. વરસાદે વિરામ લેતા વિતેલા ત્રણ-લેતા ગરમી વધી છે. ગરમીને કારણે બફારો ચાર દિવસથી મહત્તમ તાપમાનનો પારો અને ઉકળાટ વિતેલા ત્રણ ચાર દિવસથી ૩૨ ડીગ્રીની ઉપર જઇ રહ્યો છે. ન્યૂનત્ત યથાવત રહેતા લોકો અકળામણનો તાપમાનનો પારો ૨૭.૮ સેલ્સિયસ ડીંગ્રી

છવાયું રહેવાની સાથે પણ નહીં રહેવાથી લોકો સાથે ઉકળાટ અને પવનની ગતિ ધીમી પણ નહીં રહેવાથી લોકો અફારો પણ યથાવત રહેતા બફારો યથાવત પરેશાન થઈ ઊઠ્યા રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭

સુરત શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન ટકા અને દરિયાની સપાટી પર હવાનું રવિવારે શહેરનું મહત્તમ તાપમાન રવિવારે દિવસે ઉત્તર-પુર્વ દિશામાંથી ૩

દબાણ ૧૦૦૪.૦ મિલીબાર નોંધાયું છે. ૩૫.૪ ડીગ્રી નોંધાતા ગરમી અનુભવાઇ કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો.

# વલસાડઃકપરાડાના ગિરનારા ગામે એક કિલોમીટર જમીન ફાટીને ઊંડા ખાડા પડતા ગ્રામજનોમાં ફફડાટ

વલસાડના કપરાડા તાલુકાના પાંચમી સપ્ટેમ્બરના રોજ એક ગિરનારા ગામના પારસપાડા ફળિયામાં કિલોમીટર કરતા પણ વધુ

# ગામના લોકોમાં ભૂકંપને કારણે જમીન ફાટી હોવાની આશંકાઃ વરસાદને પગલે જમીન બેસી ગઈ હોવાનું તંત્રનું અનુમાન

સરકારી જમીનમાં એક કિલોમીટરના જમીનમાં ખાડા પડી જતા અંતરમાં જમીન ધસીને નીચે બેસી જતા લોકોમાં ભય ફેલાયો છે. ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે ત્રણ લોકોએ કહેવું છે કે ભૂકંપના

છે. આ ઘટનાને લઈ તંત્ર દોડતું

પારસપાડા ફળીયામાં જમીન

નીચે ૮થી ૯ ફટ જેટલી જમીન નીચે ખસી ડરી ગયા છે આ ઘટનાની જાણ તાલુકા પડી જવાની ઘટના ભૂકંપને કારણે જ થયું હોવાનું જણાવ્યું છે પરંતુ તંત્ર એ માનવું



ગઈ છે અને ૯૦ ફટ લાંબો ખાડા પડી વિકાસ અધિકારી આર. પી. પટેલ થતા જતા આ બનેલી ઘટનાને જોવા ફળિયાના તલાટી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા લોકો ઘટના સ્થળ ઉપર ધસી આવ્યા હતા. અને ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી વલસાડ ગામના લોકોના મુખે સાંભળવા મળ્યું હતું કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કે છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના ઝટકાં તેમજ ધરમપુર પ્રાંત અધિકારી તથા લાગતા હતા અને 5 સપ્ટેમ્બર એ 10.30 કપરાડા મામલતદારને કર્યો હતો. એટલું કલાકે ભૂકંપના આચકા લોકોએ અનુભવ્યા જ નહીં ગામના લોકોને પંચોમાં લેવામાં હતા અને તે લોકો દ્વારા કહેવું છે કે આ આવ્યા છે અને ગામના લોકોએ જણાવ્યું જમીન ફાટી જવાની કે જમીનમાં તિરાડો હતું કે આ ઘટના ભૂકંપના કારણે જ થયું

બોલાવાયા હતા. મહત્વની બાબત એ અડધ સભ્યો પોતાના વોર્ડ માટે, પોતાના લીધી હતી.

થતાં વૃધ્ધ રાહદારી રસ્તો ઓળંગી રહયો ચાલકે બેફ્કિકર રીતે હંકારીને રાહદારી હતો, એ સમયે પુરઝડપે ધસી આવેલી ટ્રકના લોટન સોમાલાલને અડફેટે લીધા હતા. ચાલકે રાહદારીને અડફેટે લેતાં તેનું ઘટના ટ્રક ચાલકે વૃધ્ધ લોટન સોમાને ટક્કર સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. મારતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા

સ્થિત મહાવીર મોબાઇલ શોપ પાસે .પોલીસે તેના ખીસ્સામાંથી તપાસ કરતાં કરતા મોટા ભાગના સીટીંગ સભ્યો તેમજ રસ્તા ઉપરથી લોટન સોમાલાલ (ઉ.૭૧) લોટન સોમલાલ તરીકેની ઓળખ થઇ નેતાઓના ચુંટણી લડવાના સપના અધુરા (રહે, ગ્રીન સોસાયટી, કડોદરા જી.સુરત) હતી. મૃતકના વાલી વારસો અંગે પોલીસે રહી જશે. પોતાના મત વિસ્તાર સીવાય પસાર થઇ રહયા હતા. એ સમયે પુરઝડપે તપાસ આદરી છે.

રવિવારે બપોરે પરવત પાટિયા થતાં ઘટના સ્થળે મોત નિપજયુ હતુ

છે. જેને કારણે હવે કોંગ્રેસના સભ્યો કોર્પોરેટર સાથે સંકલન રાખી તમામ શૈલેશ રાયકા, વિજય પાનસેરિયા,

માટે જીતવું અઘરું બન્યું છે. આ સંદર્ભે વાંધા સૂચનો તૈયાર કરવાને બદલે, નવા મમતા સવાણી, અરુણા ડાવરા દક્ષ આજે ઈશ્વર ફાર્મ ખાતે શહેર કોંગ્રેસની સવા કોર્પોરેટરોને કામ સોંપી દેવાયું છે. ભૂવા અને ગીતા સોસા સહીત કુલ

એક બેઠક મળી હતી. જેમાં તમામ ૩૫ વળી વાંધા સૂચનો પણ આજે રવિવારે ૧૬ સભ્યો હાજર રહ્યા હતા. બેઠક

કોર્પોરેટરોને વોર્ડ સીમાંકન માટે પોતાના બેઠક બાદ આવતીકાલે સોમવાર સાંજ શહેર પ્રમુખ બાબુ રાયકા, પૂર્વ પ્રમુખ

વાંધા સૂચનો આપવા અને ચર્ચા માટે સુધીમાં મંગાવાયા છે. ૩૫ પૈકી અડધો નૈષધ દેસાઈ, મહેન્દ્ર સુરતીયા વગેરેએ

૩૫ પૈકી ૧૬ કોર્પોરેટરો હાજર રહ્યાઃ કોંગ્રેસના ઘણા સભ્યોને પોતાના વોર્ડમાં થયેલી ફેરફારની પણ જાણકારી નહીં હોય

# NOTICE

Notice is hereby given that the following share certificates of HLE Glascoat Limited (formerly known as Swiss Glascoat Equipments Limited) are registered in our/ my name SUNITA VINOD PODDAR has/ have been lost. Since, we have purchased these shares and not traceable

at my end, i/vve have applied for issue of duplicate share certificat					
Sr. No.	Folio No.	Name of Member	Distinctive Nos.	Cert. No.	Shares (qty)
1	0001004	SUNITA VINOD PODDAR			200

So, general public are hereby warned not to deal with the following securities and if company do not receive any objection within 15 days from the date of publication of this notice on above-mentioned regd. address/of the company or to the company's R&T Agent Link Intime India Pvt Ltd (B 102 & 103, Shangrila Apts, Opp. HDFC Bank, Near Radhakrishna Chaar Rasta, Akota, Vadodara - 390020.), the company will proceed for the issue of Duplicate share certificate(s) in my/our

DATE: 06/09/2020 PLACE: NAVSARI



# મહેશ્વરી લોજીસ્ટીક્સ લિમિટેડ

CIN: L60232GJ2006PLC049224 ૨જીસ્ટર્ડ ઓફિસઃ એમએલએલ હાઉસ ,શેડ નં .એ ૨-૩/૨ ચુપીએલ , ની સામે ફર્સ્ટ ફેઝ જીઆઇડીસી ,

# કંપની ૧૪ મી વાર્ષિક સામાન્ય સભા અને રિમોટ વોટિંગ માટે નોટીસ

માથી નોટીસ આપવામાં આવે છે કે

ા. કંપનીની ૧૪મી વાર્ષિક સામાન્થ સભા (એજીએમ), બુધવાર ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ બપોરના ૨.૦૦ વાગે (ભારતીય પ્રમાણ સમય) વિડીયો કોન્ફરન્સ(વીસી)/ તથા અન્ય ઓડીયો-વિઝયુઅલ મિન્સ (ઓએવીએમ) દ્વારા યોજાશે.

. કોવિડ-૧૯ મહા રોગચાળાને ધ્યાનમાં લઇ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ( એમસીએ)ના પરિપત્ર નં.૨૦ તા. પમી મે, ૨૦૨૦ની સાથે પરિપત્ર નં. ૧૪ ૮મી એપ્રિલ ૨૦૨૦ અને પરિપત્ર નં.૧७ ૧૩મી એપ્રિલ ૨૦૨૦ (હવે ਪੂਲੀ ਗੁਮੂਡਿੰਡ ਵੀਰੇ ''ਐਮਨੀએ ਪ੍ਰਵਿਧ੍ਰਕ'' ਰਵੀਡੇ ઉલ્લੇખ કਵਰਾਮਾਂ ਆਰੂશੇ.) ਅੰਰਹੀਰ ਹੀਣੀ ਅੰਪੂਰਾ ઓએવીએમ રૂબરૂ હાજરી વિના યોજવાની મંજુરી આપવામાં આવી છે. આ એમસીએના પરિપત્ર અને કંપનીઝ એક્ટ ૨૦૧૩ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્કલોઝન રિક્વાયરમેન્ટસ) રેગ્યલેન્સ ૨૦૧૫ મુજબ કંપનીના વાર્ષિક સામાન્ય સભા વીસી/ઓએવીએમ દ્વારા યોજાશે.

જે સભ્યોએ કંપની/ડીપોઝીટરીઝ સાથે છેલ્લી તારીખ 28 મી સપ્ટેમ્બર 2020 સુધી એમસીએના ઉપર જણાવેલા પરિપત્રો તથા સેબીના ૧૨ મે ૨૦૨૦ના પરિપત્ર મુજબ ઈ-મેઈલ એડ્રેસ રજીસ્ટ્રાર્ડ કરાવ્યા હશે તેમને એજીએમની ઈલેક્ટ્રોનિક્સ નોટીસની સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના માટેના કંપનીના વાર્ષિક અહેવાલ મોકલવાની વિધી પુરી કરી લીધી છે.

આથી સભ્યોને નોંધ લેવા વિનંતી કે કંપનીની એજીએમની નોટીસ તથા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના वार्षिङ अहेवाल इंपनीनी वेजसाईट www.mlpl.biz अने स्टोङ એક्सचेन्जीस જेवी डे એनએसई લિમિટેડની વેબસાઈટ www.nseindia.com પર મુક્વામાં આવી છે. સભ્યો એજીએમમાં વીસી/ ઓએવીએમ માધ્યમ દ્વારા જ બેઠકમાં હાજરી આપી શકશે/ભાગ લઈ શકશે. કંપની એક્ટ ૨૦૧૩ ના ખંડ ૧૦૩ મુજબ આવી હાજરીને કોરમ તરીકે ગણતરીમાં લઈ શકાશે.

. કંપની તરફથી તમામ સભ્યોની નોટીસમાં જણાવ્યા મુજબની ઠરાવો પર મતદાન કરવા કંપની તરફથી નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસર્ઇએલ) મારફતે રિમોટ ઇ-વોર્ટિંગ ફેસિલિટિ (રિમોટ ઈ-વોટિંગ) પુરી પાડવામાં આવેલ છે. વધુમાં કંપની તરફથી એજીએમમાં મતદાન કરવા માટે ઈ-વોટિંગ સિસ્ટમ મારકતે ઈ-વોટિંગની સવિધા પણ પરી પાડવામાં આવી છે.

રિમોટ વોટિગ/ઇ-વોટિગ અને એજીએમની ની નોટીસમાં જણાવ્યા મુજબની કાર્યવાહીમાં જોડાવા અને

i રિમોટ ઈવોટિંગ રહમી સપ્ટેમ્બર ૨૦૨૦(ભારતીય પ્રમાણ સમય મુજબ સવારે ૯.૦૦ વાગ્યાથી) શરૂ થઈ જશે અને સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૦ (ભારતીય પ્રમાણ સમય મુજબ સાંજે ૫.૦૦ વાગ્યા) પુરૂ થઈ જશે. સાંજે પ વાગ્યા બાદ ઈ-વોટિંગની મંજૂરી આપવામાં નહીં આવે.

ii જે લોકો કટ ઓફ ડેટ એટલે કે સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૦ના રોજ નવા શેરદ્યારકો બન્યા હશે તેમણે પણ નોટીસમાં જણાવ્યા મુજબની ઈ-વોટિંગ પ્રક્રિયા અપનાવાની રહેશે.

iii સભ્યોએ નોંધ લેવી કે મિટીંગ દરમિયાન ઠરાવ પર એક વખત મતદાન કર્યા બાદ તેમાં કોઈ કેરકાર કરી શકાશે નહીં. સભ્યો કે જેમણે મીટીંગમાં હાજરી આપી અગાઉ રિમોટ વોટિંગ દ્વારા મતદાન કર્યું હશે અને મિટીંગમાં હાજરી આપી હશે તે ફરીથી મતદાન નહીં કરી શકે. એજીએમમાં ઈવોટિંગ દ્વારા મત આપવાની સુવિધા પુરી પાડવામાં આવશે.

iv એજીએમની સૂચનામાં ઇલેક્ટ્રોનિક મતદાનની પ્રક્રિયા ઉપલબ્ધ છે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરહોલ્ડરો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરહોલ્ડરો માટે ઇ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો .: 1800-222 -990 અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલો.

v સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે એજીએમની નોટીસમાં આપવામાં આવેલી નોંધ કાળજીપુવક વાંચી જવી અને એજીએમમાં જોડાવા માટેની સુચના તથા રિમોર્ટ થી વોટિંગ અથવા ઈ-વોટિંગ કરવા માટેની પદ્ધતિ સમજી લેવી.

તારીખઃ 05.09.2020

બોર્ડ ના હુક્મ થી મહેશ્વરી લોજીસ્ટીક્સ લિમિટેંડ વતી

# **સુરતા, તા.૬** નગર પાલિકા અને ૨૭ ગામડાનો સમાવેશ છે. આ ફેરફારના કાર**િ**ગઇ ટર્મમાં સુરત જિલ્લા પંચાયતના નવી ૩૬ સુરત જિલ્લા પંચાયતના જાહેર થયેલા થતા શહેરનો વિસ્તાર વધી ગયો છે. જયારે સામાન્ય બેઠક પરથી જે સભ્ય ચુટાઇને બેઠકોની રચના બાદ જો કોઇ વ્યક્તિએ

વોર્ડ સીમાકન બાદ ભાજપમાં ભારે કચવાટ સુરત જીલ્લા પંચાયતનું કદ ઘટી ગયું છે. આવ્યા હતા તે બેઠક સામાન્યમાંથી વાધો-સુચન રજુ કરવો હોય તો અરજદાર જોવા મળી રહ્યો છે. શહેરમાં સમાવેશ પરીણામે તાજેતરમાં જાહેર કરાયેલા વોર્ડ આદિજાતિ સ્ત્રી કે પછી અન્ય કેટગરીમાં દિન-૧૦માં કલેકટર કચેરી રજુઆત થયેલા વિસ્તારોની બાદબાકી કર્યા બાદ ચૂંટણી પંચે બેઠકો અને કેટગરી ફેરફાર

પાસેથી જાણવા મળે છે.

ચુકવી આપવા જણાવ્યુ હતું.

છોડાવવા માટે આમંત્રીત કર્યા છે

તારીખઃ ૦૩.૦૯.૨૦૨૦ | સ્થળઃ સુરત

डेनरा भेंड 🖒 Canara Bank

📆 सिंडिकेट Syndicate

કેનરા બેંક 🔬 Canara Bank

🐻 सिंडिकेट Syndicate

મોટાભાગલની સામાન્ય બેઠકો અનામત કેટેગરીમાં આવી જવાથી ચૂંટણી લડવા અન્ય વિસ્તાર પસંદ કરવો પડે તેવી હાલત

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

ન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪મી કલમ

અન્વયે કેનરા બેંક નાં ઓથોરાઈઝડ ઓફ્સિરે કલમ ૧૩(૧૨)ની સાથે વંચાતા

સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ હેઠળ મળેલી સત્તાની

રૂએ, તા. ૦૨.૦૩.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ મોકલી કરજદાર શ્રી ગોધાની

**દીપકભાઈ ખીમાભાઈ અને શોભનાબેન દીપકભાઈ ગોધાની** ને નોટીસમાં જણાવેલ

રૂપિયા ૧૮,૧૧,૭૦૬.૪૫ (અંકે અઢાર લાખ અગિયાર હજાર સાતસો છ અને પીસ્તાલીસ

**પૈસા પુરા) તા. ૨૯.૦૨.૨૦૨૦ સુધી** સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં

નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ

૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલી સત્તાની રૂએ

અંગે કોઈપણ વ્યવહાર નહી કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત

અંગેના કોઈપણ વ્યવહાર **કેનરા બેંક** ની બાકી નીકળતી **રૂપિયા ૧૮.૧૧.૭૦૬.૪૫** 

(અંકે અઢાર લાખ અગિયાર હજાર સાતસો છ અને પીસ્તાલીસ પૈસા પુરા) તારીખ

**તારીખ 03.0૯.૨૦૨૦** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઈ લીધેલ છે.

રે૯.૦૨.૨૦૨૦ **સુધી અને તેના પરનું વ્યાજ** ને આધીન રહેશે.

કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદાર અને આમજનતાને

આથી ખાસ કરીને કરજદાર / જામીદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) અંતર્ગત દેવાદારને સુરક્ષીત અસ્ક્યામતો

સ્થાવર મિલકતનું વર્ણન

પ્લોટ નં. ૫૭, 'બી' ટાઈપ, ગુકુલમ રેસીડેન્સી, મીરા રેસીડેન્સી પાસે, શેખપુર રોડ,

વિલંજા, કામરેજ, રેવન્યુ સર્વે નં. ૫૪, બ્લોક નં. ૪૦, ગામ: વેલંજા, તાલુકા:

કામરેજ, જીલ્લો સરત, ટોટલ ક્ષેત્રફળ આશરે ૧૦૧.૧૭ ચો.મી. ખાતે આવેલ

ગોધાની દીપકભાઈ ખીમાભાઈ અને શોભનાબેન દીપકભાઈ ગોધાની ની માલિકીની

મિલકતનો ભાગ અને હીસ્સો. **ચતુર્સીમાઃ ઉત્તરઃ** અડીને સીઓપી, **દક્ષિણઃ** અડીને

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪મી કલમ) અન્વયે

કેનરા બેંક નાં ઓથોરાઈઝડ ઓફ્સિરે કલમ ૧૩(૧૨)ની સાથે વંચાતા સિક્યોરિટી

ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ૩લ્સ. ૨૦૦૨ના નિયમ ૩ હેઠળ મળેલી સત્તાની ૩એ. તા.

૦૨.૦૩.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ મોકલી કરજદાર રાકેશ શાંતીલાલ ચૌહાણ અને

અલકાબેન રાકેશ ચૌહાણને નોટીસમાં જણાવેલ રૂપિયા ૧૨,૪૯,૮૦૪.૫૯ (અંકે બાર

લાખ ઓગણપચાસ હજાર આંઠસો ચાર અને ઓગણસાંઠ પૈસા પુરા) તા. ૨૯.૦૨.૨૦૨૦

નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪)

સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલી સત્તાની રૂએ **તારીખ** 

કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદાર અને આમજનતાને

આથી ખાસ કરીને કરજદાર / જામીદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) અંતર્ગત દેવાદારને સુરક્ષીત અસ્ક્યામતો

અંગે કોઈપણ વ્યવહાર નહી કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત અંગેના

કોઈપણ વ્યવહાર કેનરા બેંક ની બાકી નીકળતી રૂપિયા ૧૨,૪૯,૮૦૪.૫૯ (અંકે બાર

લાખ ઓગણપચાસ હજાર આંઠસો ચાર અને ઓગણસાંઠ પૈસા પુરા) તારીખ

સ્થાવર મિલકતનું વર્ણન

પ્લોટ નં. ૫૬, શ્રી વીલા રેસીડેન્સી વિભાગ-૨ થી જાણિતી સોસાયટી, મોટા,

બારડોલી, રેવન્ય સર્વે નં. ૭૦. બ્લોક નં. ૧૧૯. ગામ: મોટા, જીલ્લો: બારડોલી,

સરત ખાતે આવેલ **શ્રી રાકેશ શાંતીલાલ ચૌહાણ અને અલાકબેન રાકેશ ચૌહાણ** ની

માલિકીની મિલકતનો ભાગ અને હીસ્સો. ટોટલ ક્ષેત્રફળ આશરે ૬૦.૧૯ ચો.મી

ચતુર્સીમા: ઉત્તર: પ્લોટ નં. ૫૫, **દક્ષિણ:** સોસાયટી રોડ, **પૂર્વ:** રોડ અને પ્રવેશ માર્ગ

**સુધી** સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં ચૂકવી આપવા જશાવ્યુ હતું.

**૦૩.૦૯.૨૦૨૦** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઈ લીધેલ છે.

**૨૯.૦૨.૨૦૨૦ સુધી અને તેના પરનું વ્યાજ** ને આધીન રહેશે.

છોડાવવા માટે આમંત્રીત કર્યા છે.

જ્યારે સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફ્રાયનાન્સિયલ એસેટ્સ એન્ડ

અધિકૃત અધિકારી, કેનરા બેંક

પાર્લે પોઈન્ટ શાખા,

સુરત

પ્લોટ નં. એ/૫૮, **પૂર્વ:** અડીને રોડ, **પશ્ચિમ:** અડીને પ્લોટ વાળી મિલકત.

જ્યારે સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ

હોય બેઠકોના રોટેશન અંગે પ્રદેશ પ્રમુખને બેઠકોમાં ૪ બેઠકનો ઘટાડો થતા હવે ૩૬ સીટીગ સભ્યમાં ભારે કચવાટ જોવા મળી જાહેરનામામાં ફેરફાર કરવામાં આવે તેની રજુઆત કરવામાં આવી હોવાનું સુત્રો બેઠકો પરથી ઉમેદવારો ચૂંટણી લડશે. ૪ રહ્યો છે. બેઠકની કેટેગરીમાં ફેરફાર થતા શક્યતા નહીવત છે. તેમ છતા ભાજપના છે ફળીયાથી ૭૦૦થી ૮૦૦ મીટરના છે કે જમીન બેસી જવાર્થો ઘટના બની છે. બેઠકના ઘટાડા સાથે ચુંટણી પંચે રોટેશન ચુંટણી લડવા માટે થનગનતા નેતાઓએ આગેવાનોએ આ અંગે પ્રદેશ પ્રમુખને હદવિસ્તરણ બાદ સુરત શહેરમાં બે મુજબ બેઠકોની કેટગરીમાં ફેરફાર કર્યો હવે અન્ય બેઠકો પરથી ચૂંટણી લડવી પડશે. રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

પાર્લે પોઈન્ટ શાખા,

સુરત

અન્ય બેઠક પરથી ચુંટણી લડવુ મુશ્કેલ સીમાંકનમાં સુરત જિલ્લા પંચાયતની ૪૦ લઇ જવાથી ભાજપના આગેવાનો તેમજ કરી શકે છે. ચુંટણી પંચે પ્રસિધ્ધ કરેલા

પાર્લે પોઈન્ટ શાખા,

કેનરા બેંક \Delta Canara Bank 👪 सिंडिकेट Syndicate

સુરત ક્બજા નોટીસ (સ્થાવર મિલક્ત માટે)

જ્યારે સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ એન્ડ ન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪મી કલમ) મન્વયે કેનરા બેંક નાં ઓથોરાઈઝડ ઓફ્સિરે કલમ ૧૩(૧૨)ની સાથે વંચાતા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ હેઠળ મળેલી સત્તાની રૂએ, **તા. ૦૩.૦૩.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ** મોકલી કરજદાર **કાનાભાઈ ભુરાભાઈ દંગર અને રણછોડભાઈ બી. દંગર અને જોઘાભાઈ ભુરાભાઈ દંગર** ને નોટીસમાં જેશાવેલ **રૂપિયા ૨૦,૪૦,૭૮૯.૫૬ (અંકે વીસ લાખ ચાલીસ હજાર સાતસો નેવ્યાશી** અને છપ્પન પૈસા પુરા) તા. ૨૯.૦૨.૨૦૨૦ સુધી સદરહુ નોટીસ મળ્યાની તારીખથી

૬૦ દિવસમાં ચૂકવી આપવા જણાવ્યુ હતું . કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદાર અને આમજનતાને નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલી સત્તાની રૂએ **તારીખ ૦૩.૦૯.૨૦૨૦** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઈ લીધેલ છે.

આથી ખાસ કરીને કરજદાર / જામીદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત અંગે કોઈપણ વ્યવહાર નહી કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત બંગેના કોઈપણ વ્યવહાર **કેનરા બેંક** ની બાકી નીકળતી **રૂપિયા ૨૦,૪૦,૭૮૯.૫૬** (અંકે વીસ લાખ ચાલીસ હજાર સાતસો નેવ્યાશી અને છપ્પન પૈસા પુરા) તારીખ . **૨૯.૦૨.૨૦૨૦ સુધી અને તેના પરનું વ્યાજ** ને આધીન રહેશે.

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) અંતર્ગત દેવાદારને સુરક્ષીત અસ્કયામતો છોડાવવા માટે આમંત્રીત કર્યા છે.

સ્થાવર મિલકતનું વર્ણન

પ્લોટ નં. ૧૪૪, શિવ નગર થી જાણીતી સોસાયટી, દાદા ભગવાન મંદિર પાછળ, કામરેજ, રેવન્ય સર્વે નં. ૩૬૦, બ્લોક નં. ૩૪૭, ગામ: કામરેજ, જીલ્લો સરત, ખાતે આવેલ કાનાભાઈ ભરાભાઈ દંગર અને રણછોડભાઈ બી. દંગર અને જોઘાભાઈ **ભરાભાઈ** ની માલિકીની મિલકતનો ભાગ અને હીસ્સો. ટોટલ એરીયા ૯૮.૪૩ ચો.મી. **ચતુર્સીમાઃ ઉત્તરઃ** અડીને પ્લોટ ૧૪૩, **દક્ષિણઃ** અડીને પ્લોટ નં. ૧૪૫, **પૂર્વઃ** અડીને બ્લોક નંબર, **પશ્ચિમ:** અડીને સોસાયટી રોડ.

તારીખઃ ૦૩.૦૯.૨૦૨૦ | સ્થળઃ સુરત

અધિકૃત અધિકારી, કેનરા બેંક

કેનરા બેંક 🔬 Canara Bank 🜃 सिंडिकेट Syndicate

પાર્લે પોઈન્ટ શાખા, સુરત

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) જ્યારે સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ

મેન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪મી કલમ)

બન્વયે કેનરા બેંક નાં ઓથોરાઈઝડ ઓફ્સિરે કલમ ૧૩(૧૨)ની સાથે વંચાતા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ હેઠળ મળેલી સત્તાની રૂએ, **તા. ૦૨.૦૩.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ** મોકલી કરજદાર **શ્રી ઉપમા બીજય** <mark>પાં</mark>ડેને નોટીસમાં જણાવેલ **રૂપિયા ૧૪,૨૫,૩૦૪.૯૩ (અંકે ચૌદ લાખ પચ્ચીસ હજાર** ત્રણસો ચાર અને ત્રાણું પૈસા પુરા) તા. ૨૯.૦૨.૨૦૨૦ સુધી સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં ચૂકવી આપવા જણાવ્યુ હતું. કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદાર અને આમજનતાને

નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલી સત્તાની રૂએ **તારીખ ૦૩.૦૯.૨૦૨૦** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઈ લીધેલ છે. આથી ખાસ કરીને કરજદાર / જામીદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત

અંગે કોઈપણ વ્યવહાર નહી કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત અંગેના કોઈપણ વ્યવહાર **કેનરા બેંક** ની બાકી નીકળતી **રૂપિયા ૧૪,૨૫,૩૦૪.૯૩ (અંકે ચૌદ** લાખ પચ્ચીસ હજાર ત્રણસો ચાર અને ત્રાણું પૈસા પુરા) તારીખ ૨૯.૦૨.૨૦૨૦ સુધી અને **તેના પરનં વ્યાજ** ને આધીન રહેશે.

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) અંતર્ગત દેવાદારને સુરક્ષીત અસ્કયામતો છોડાવવા માટે આમંત્રીત કર્યા છે.

પ્લોટ નં. ૧૭૬, રાજદીપ રો-હાઉસ, રેવન્યુ સર્વે નં. ૧૨૭, બ્લોક નં. ૧૨૭, ગામ કરદવા ખાતે આવેલ **ઉપમા બીજય પાંડે** ની માલિકીની મિલકતનો ભાગ અને હીસ્સો. **ચતુર્સીમાઃ ઉત્તરઃ** સોસાયટી રોડ, **દક્ષિણઃ** અડીને પ્લોટ ૧૭૭, **પૂર્વઃ** અડીને પ્લોટ નં ૧૭૫, **પશ્ચિમ:** સોસાયટી રોડ.

તારીખઃ ૦૩.૦૯.૨૦૨૦

અધિકૃત અધિકારી, કેનરા બેંક

# Canara Bank ફેબરા ભેંક 🚓 🌃 सिंडिकेट Syndicate

ઘોડદોડ રોડ શાખા, સુરત

ક્લજા નોટિસ [SECTION 13(4)]

**डेनरा जेन्डना** नीचे राही हरनार अधिहृत अधिहारीએ सिह्योरीटाएजेशन એन्ड रिडन्स्ट्रड्शन ओड़ ड्राइनान्सियल असेट्स अन्ड अन्डोर्समेन्ट ओड़ सिड्योरिटी इन्टरेस्ट એडट २००२(२००२नी એडट ५४)(७वे पछीथी डायहा तरीडे निर्हीष्ट) અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨)ના નિયમ ૩ સહિત વંચાછે લેતાં મળેલ સત્તાની રૂએ **તા.૧૧-૦૨-૨૦૨૦ ના રોજ માંગણા નોંદિ**સ પાઠવી તી જે અનુસાર બેંકના ૠણકર્તા ૧) કિશોરભાઇ મોહનભાઇ પેધડીયા અને ૨) મેનાબેન કિશોરભાઇ પૈદાડીયાને નોટિસમાં જણાવ્યા મુજબ બેંકના લેણાંની ૨કમ ગ્રા.૨૧,૮૦,૩૨૨.૬૨ (રુપિયા એકવીસ લાખ એંશી હજાર ત્રણસો બાવીસ અને પૈસા બાસક પૂરા) આ નોટિસ મળ્યેથી ૬૦ દિવસની અંદર ચૂકવવા માટે જણાવેલ.

દેવાદાર બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી ખાસ દેવાદાર અને જાહેર rનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ जी**चे જણાવેલ મિલકત**નો तेमने સદર કાયદાની કલમ ૧૩(૪) રુલ नं. ८ અને લ साथे वंचाले लेतां भणेल रातानी ऋगे नीचे दशविल भिलडतनो ता.०३-०६-२०२०न हेवाहारने जारा अने कहेर क्नताने सामान्यतः येतवात्री आपवामां आवे छे ह

नीचे क्यावेल भिलंडत साथे डोछपए प्रडारनो व्यवहार डरवो नहीं मथवा डोछपए પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો **કેનરા બેંક ના રૂા. ૨૨,૫૯,૩૪૦.૬૨ (રુપિયા બાવીર લાખ ઓગણસાઇઠ હજાર ત્રણસો ચાલીસ અને પૈસા બાસઠ પૂરા)**વતા તેની પર ચડતા વ્યાજ ાગેરેના બોજાને આઘીન રહેશે. "દેવાદારને સરફેસી એક્ટની સેક્શન ૧૩ની પેટા ક્લમ (૮)ની જોગવાઇઓ અનુસાર

स्थावर भिलडतनुं वर्शन :

સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો - પ્લોટ નં.૪૨, એવરવીલા રૉ હાઉસ, બ્લોક નં ર૧૧(જૂનો સર્વે નં. ૧૧૭/૧) ગામ સાયણ, તાલુકા ઓલપાડ, ડિ. સુરત- ૨૮,૫૫,૦૦૦, - કિંમતનો, કે જેની ચતુ:સીમા નીચે મુજબ છે: ઉत्तरे : प्वोट नं.२७, हक्षिणे : सोसायटी रोड,

પૂર્વે : બ્લોક નં. ૨૧૦, પશ્ચિમે : પ્લોટ નં.૪૧.

વારીખ : 03-06-૨૦૨૦

કેનરા બેંક 📣 Canara Bank પાર્લે પોઈન્ટ શાખા, 된રત 📆 सिंडिकेट Syndicate

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

જ્યારે સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફ્રાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪મી કલમ) અન્વયે કેનરા બેંક નાં ઓથોરાઈઝડ ઓફ્સિરે કલમ ૧૩(૧૨)ની સાથે વંચાતા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ હેઠળ મળેલી સત્તાની રૂએ, તા. ૦૨.૦૩.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ મોકલી કરજદાર શ્રી કીશન ભટુભાઈ **રાજપુત** ને નોટીસમાં જણાવેલ **રૂપિયા ૧૫,૯૪,૨૮૦.૫૬ (અંકે પંદર લાખ ચોરાણું** હજાર બસો એંશી અને છપ્પન પૈસા પુરા) તા. ૨૯.૦૨.૨૦૨૦ સુધી સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં ચૂકવી આપવા જણાવ્યુ હતું.

કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદાર અને આમજનતાને નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલી સત્તાની રૂએ **તારીખ ૦૩.૦૯.૨૦૨૦** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઈ લીધેલ છે.

આથી ખાસ કરીને કરજદાર / જામીદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત અંગે કોઈપણ વ્યવહાર નહી કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત અંગેના કોઈપણ વ્યવહાર **કેનરા બેંક** ની બાકી નીકળતી **રૂપિયા ૧૫,૯૪,૨૮૦.૫૬** (અંકે પંદર લાખ ચોરાણું હજાર બસો એંશી અને છપ્પન પૈસા પુરા) તારીખ ૨૯.૦૨.૨૦૨૦ સુધી અને તેના પરનું વ્યાજ ને આધીન રહેશે.

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) અંતર્ગત દેવાદારને સુરક્ષીત અસ્કયામતો છોડાવવા માટે આમંત્રીત કર્યા છે.

સ્થાવર મિલકતનું વર્ણન

પ્લોટ નં. ૨૦/આઈ, સોસાયટીનું નામ સાહકર પાર્ક વિભાગ-૧, સોયાની, પલસાણા રેવન્ય સર્વે નં. ૧૯૧+૧૯૩+૧૯૪ અને ૧૯૫/૧. બ્લોક નં. ૨૧૭ અને ૨૨૫. ગામ: |સોયાની, તાલુકા: પલસાણા, જીલ્લો: સુરત ખાતે આવેલ **કિશનભાઈ ભટ્ભાઈ રાજપૃત** ીની માલિકીની મિલકતનો ભાગ અને હિસ્સો. ટોટલ ક્ષેત્રફળ આશરે ૬૨.૫૭ ચો.મી ચતુર્સીમા: ઉત્તર: પ્લોટ નં. ૧૯/જે, **દક્ષિણ:** સોસાયટી રોડ, **પૂર્વ:** સોસાયટી રોડ, **પશ્ચિમ:** પ્લોટ નં . ૪૭/આઈ

તારીખઃ ૦૩.૦૯.૨૦૨૦ | સ્થળઃ સુરત અધિકૃત અધિકારી, કેનરા બેંક

#### પરેશ રેચાણી કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર તારીખઃ ૦૩.૦૯.૨૦૨૦ | સ્થળઃ સુરત અધિકૃત અધિકારી, કેનરા બેંક સ્થળઃ સુરત Frinted by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Ring Road, R